

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૪/૧૨/૨૦૧૬ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૦૮/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૨ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી ૮૩ લીટર દેશી દારૂ અને ૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૨૪ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૧,૦૮,૫૨૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૩૦૯/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૦૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૩૧૦/૧૬

આનંદનગર: પલ્લવી વા\ઓ અનિરવન દાસ (રહે. સિઝોર રેસીડન્સી ધનંજય ટાવર પાછળ,શ્યામલ ચાર રસ્તા પાસે આનંદનગર) એ તા.૧૩/૧૨/૧૬ નારોજ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે પોતાના ઘરે કામ કરતા (૧) વિમલા વા/ઓ જીવન કટારા (૨) જીવન કટારા (બન્ને રહે. ભીલકુમાર સોસાયટી, મુળ વતન ગામ-નરડીયા તા.જી. ડુંગરપુરા રાજસ્થાન) તા.૬/૧૨/૧૬ બપોરના ૩/૦૦ થી ૩/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાંથી (૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જુની નોટો) રોકડ રૂપિયા ૭,૯૦,૦૦૦/- ચોરી કરી લઈ નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એફ.એ.પારગી ચલાવે છે.

ઓઢવ: રાજેન્દ્રભાઈ નાનુભાઈ ભટ્ટ (રહે.વિસત એપાર્ટમેન્ટ બોડકદેવ) એ તા.૧૩/૧૨/૧૬ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે ઓઢવ ગુજરાત વેપારી મહામંડળ પ્લોટ નં.૧૦૧ અને ૧૦૩ જી.એસ.પી.કોપ સાયંસ પ્રા.લીમીટેડ કંપનીમાં કામ કરતા કોઈ કર્મચારીઓએ તા.૭/૯/૧૬ કલાક ૧૦/૦૦ થી તા.૧૦/૯/૧૬ બપોરના ૪/૦૦ વાગ્યા દરમ્યાન કંપનીમાંથી જંતુનાશક દવા (ડાયફેન થાયુરોન ટેક) બેગ નંગ-૧૬ કિમત રૂપિયા ૫,૧૮,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ હે.કો શ્રી દેવેન્દ્રભાઈ રામાભાઈ ચલાવે છે.

સોનાનો ઢોરો ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૩૧૧/૧૬

નિકોલ: જયોત્સનાબહેન ઘનશ્યામભાઈ પટેલ (રહે. સાકાર સોસાયટી નિશાત બંડ્લોઝની પાછળ નિકોલ) તા.૧૩/૧૨/૧૬ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે નિકોલ નરોડા રોડ ખોડલધામ સોસાયટી સામે રામજીમંદિર પાસે નિશાંત બંડ્લોઝ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઁક મોટર સાયકલ ઉપર આવેલ (૩૦ થી ૩૫ વર્ષના આશરાના) બે પુરુષ જયોત્સનાબહેનના ગળામાંથી સોનાનો ઢોરો કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ જયોત્સનાબહેન પટેલે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.સી.છત્રાલીયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.